

૧. દરેક પ્રશ્નનો [a] અથવા [a(i)] અને [a(ii)] જ લખવાના રહેશે.  
 ૨. પ્રશ્ન : ૧[a] અથવા ૧[a(i)] અને ૧[a(ii)] તથા ૨[a] અથવા ૨[a(i)] અને ૨[a(ii)] ના 14 માર્કસ ના બદલે ૧૮ માર્કસ રહેશે.  
 ૩. પ્રશ્ન : ૩[a] અથવા ૩[a(i)] અને ૩[a(ii)] તથા ૪[a] અથવા ૪[a(i)] અને ૪[a(ii)] ના 14 માર્કસ ના બદલે ૧૭ માર્કસ રહેશે.  
 ૪. દરેક પ્રશ્નનો પ્રશ્ન નં ૧(b), પ્રશ્ન નં ૨(b), પ્રશ્ન નં ૩(b) તથા પ્રશ્ન નં ૪(b) (ટુંકા પ્રશ્નો) વિદ્યાર્થીએ લખવાના નથી.

પ્રશ્ન-૧. અ પર્યાવરણ મનોવિજ્ઞાન એટલે શું? તેનું સ્વરૂપ સમજાવો.

અથવા

૧૪

પ્રશ્ન-૧. અ-(i) પર્યાવરણ મનોવિજ્ઞાનની ઉપયોગિતા સમજાવો.

૭

પ્રશ્ન-૧. અ-(ii) હવા પ્રદૂષકો અને તેના પરિણામો જણાવો.

૭

પ્રશ્ન-૧. બ કોઈપણ ચારનાં જવાબ આપો.

૪

૧ પર્યાવરણના મનોવિજ્ઞાનને અંગેજ્માં શું કહે છે?

૨ પર્યાવરણના મનોવિજ્ઞાન કોની સાથે સંબંધ ધરાવે છે.

૩ પર્યાવરણના મનોવિજ્ઞાનના પરિવત્ત્યો ક્યાં ક્યાં છે?

૪ WHO નું પ્લેન નામ આપો.

૫ હવા પ્રદૂષણ એટલે શું?

૬ હવામાનને અંગેજ્માં શું કહે છે?

પ્રશ્ન-૨. અ પર્યાવરણના ઉદ્દીપનની કક્ષા અને માનવની પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ લખો

૧૪

અથવા

પ્રશ્ન-૨. અ-(i) પર્યાવરણના ઉદ્દીપનો પ્રત્યેની પ્રતિક્રિયા સમજાવો.

૭

પ્રશ્ન-૨. અ-(ii) પ્રદૂષણ નિયંત્રણ સમજાવી.

૭

પ્રશ્ન-૨. બ કોઈપણ ચારનાં જવાબ આપો.

૪

૧ માણસ ક્યાં પર્યાવરણમાં રહે છે?

૨ માણસ શેનાથી રક્ષણ મેળવે છે?

૩ પર્યાવરણના ઉદ્દીપનની કક્ષા કેટલી છે?

૪ ઉદ્દીપનનો અતિરેક ક્યારે થાય છે?

૫ ઓધોગિક પ્રદૂષણની વ્યાખ્યા આપો.

૬ ઓધોગિક પ્રદૂષણના લીધે ક્યાં રોગ થાય છે?

અથવા

૧૪

પ્રશ્ન-૩. અ ધ્વનિ/અવાજની લાક્ષણિકતા સમજાવી.

૭

પ્રશ્ન-૩. અ-(i) ધોઘાટના વિક્ષેપકારક લક્ષણો જણાવો.

૭

પ્રશ્ન-૩. અ-(ii) અસાધારણ વાતાવરણ વિષયક ઉતેજનાઓની ચર્ચા કરો.

૭

પ્રશ્ન-૩. બ કોઈપણ ત્રણનાં જવાબ આપો.

૩

૧ અવાજ કેવી રીતે ઉદભવે છે.

૨ Herts ને ટ્રેકમાં શું કહેવાય?

૩ Hz શું દર્શાવે છે.

૪ ધોઘાટનું કદ કેટલું હોય છે?

૫ જગત કેવું છે?

પ્રશ્ન-૪. અ ઉષ્ણતામાનોની હવામાનની વિવિધ કક્ષાની અસરો સમજાવો. અથવા

૧૪

પ્રશ્ન-૪. અ-(i) માનવ વર્તન પર હવામાનની અસરો જણાવો.

૭

પ્રશ્ન-૪. અ-(ii) કર્તૃત્વ પર ગરમીની અસરો સમજાવો.

૭

પ્રશ્ન-૪. બ કોઈપણ ત્રણનાં જવાબ આપો.

૩

૧ જાનેન્ડ્રિયો કેટલી છે?

૨ સમુક તટે કેવી હવા હોય છે?

૩ શરીરનું સાધારણ ઉષ્ણતામાન કેટલું હોય છે.

૪ સનસ્ટોકથી શું થાય છે?

૫ ઉષ્ણતામાનનું માપન શેના દ્વારા થાય છે.